Read. Office :-

330, TRIVIA Complex, Natubhai Circle,

Racecourse, Vadodara - 390007, Gujarat, INDIA

Phone: +91 265 2988903 / 2984803

Website: www.chemcrux.com
Email: girishshah@chemcrux.com





1st September 2022

To, Corporate Relations Department BSE LIMITED,

Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai- 400 001

Dear Sir/Madam,

Subject Newspaper publication of 26th AGM Notice pursuant to Reg. 47 of SEBI (Listing

Obligation and Disclosure Requirement) Regulations, 2015

Ref.: BSE Scrip ID: CHEMCRUX

BSE Scrip Code: 540395

With reference to the above subject and pursuant to Regulation 47 of SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulations, 2015, we hereby enclose the copy of newspaper advertisement published on 01st September 2022 in Financial Express (English edition) and in Financial Express (Gujarati edition) intimating about the Notice of 26th Annual General Meeting of the Company through Video conference, Book Closure, E voting, Record date and other related matters.

Kindly take the same on your records.

Thanking you,

Yours faithfully,

For, CHEMCRUX ENTERPRISES LIMITED

Dipika Rajpal

Company Secretary and Compliance Officer

Encl.: As above

FINANCIAL EXPRESS

ABHEY OSWAL

Oswal Agro Mills Limited

CIN: L15319PB1979PLC012267 Registered Office: Near Jain Colony, Vijay Inder Nagar, Daba Road, Ludhiana-141003 (Punjab)

INFORMATION REGARDING 42nd ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCING/ OTHER AUDIO VISUAL MEANS

NOTICE is hereby given that the 42rd Annual General Meeting ("AGM") of Oswal Agro Mills Limited ("the Company")is scheduled to be held on Wednesday, September 28, 2022 at 03.00P.M. (IST) through Video Conferencing ("VC")/Other Audio-Visual Means ("OAVM") facility to transact the businesses as set out in the Notice of AGM. In view of continuing pandemic, social distancing is a pre-requisite that needs to be followed. Ministry of Corporate Affairs (MCA) vide circular Nos. 02/2022,02/2021, 14/2020, 17/2020 and 20/2020 dated May 5, 2022, January 13, 2021, April 8, 2020, April 13, 2020 and May 5, 2020 respectively (MCA Circulars) and Securities and Exchange Board of India (SEBI) vide circular No. SEBI/HO/CFD /CMD2/CIR/P/2022/62, SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 and SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 13, 2022, January 15, 2021 and May 12, 2020 respectively (SEBI Circulars) have permitted the holding of AGM through VC/OAVM.

In compliance with the aforesaid circulars and the applicable provisions of the Companies Act, 2013 ("the Act") and the Rules made thereunder and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the 42nd AGM of the Company is scheduled to be held through VC/OAVM.

In accordance with the aforesaid circulars, electronic copies of the Notice of AGM and the Annual Report of the Company for the financial year 2021-22 will be sent only through email to those Members whose email addresses are registered with the Company or the Depositories/ Depository Participant (s). Members may please note that these documents will also be available on the Company's website (www.oswalagromills.com), Stock Exchange website -BSE Limited (www.bseindia.com) and National Stock Exchange of India Limited (www.nseindia.com) and the website of NSDL (Agency for providing e-voting facility) at www.evoting.nsdl.com. Members can attend and participate in the AGM through VC/ OAVM facility only. Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum as per section 103 of the Companies Act, 2013. The instructions for joining the AGM shall be provided in the notice of the AGM.

The Company is providing remote e-voting facility ("Remote evoting") to all its members to cast their votes on all resolutions as set out in the notice of the AGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the AGM ("e-voting"). Detailed procedure for remote e-voting/ evoting shall be provided in the Notice of the AGM.

Members holding shares either in physical form or in dematerialised form, as on cut-off date i.e., Wednesday, September 21, 2022 may cast their vote electronically on the Businesses, as set out in the Notice of the 42" AGM through electronic voting system ("remote e-voting") of National Securities Depository Limited ("NSDL"). All the members are informed that:

- The businesses, as set out in the Notice of the 42rd AGM, will be transacted through voting by electronic means;
- The remote e-voting will commence on Sunday, September 25, 2022 at 09:00 A.M. (IST) and will end on Tuesday. September 27, 2022 at 05:00 P.M. (IST).
- iii) The cut-off date, for determining the eligibility to vote through remote e-voting or through the e-voting system during the 42ⁿ² AGM, is September 21, 2022.
- iv) Any person, who becomes member of the company after sending the Notice of the 42" AGM by email and holding shares as on the cut -off date i.e., September 21, 2022, may obtain the login ID and password by following the instructions as mentioned in the notice of 42nd AGM or sending a request to NSDL at evoting@nsdl.co.in. However, if he/she is already registered with NSDL for remote e-voting, then he/she can use his/her existing user id and password to cast their vote.

Members may note that : a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on resolution is cast by the member shall not be allowed to change it subsequently; b) the members who have cast their vote by remote e-voting prior to the 42" AGM may participate in the 42[™] AGM through VC/OAVM facility but shall not be entitled to cast their vote again through the e-voting system during the 42nd AGM, c) the members participating in the 42" AGM and who had not cast their vote by remote e-voting, shall be entitled to cast their vote through e-Voting system during the 42" AGM; and d) a person whose name is recorded in the Register of Members or in Register of Beneficial Owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting, participating in the 42" AGM through VC/OAVM facility and e-voting during the

The login credentials for casting votes through remote e-voting/ e-voting shall be made available to the Members through email. Members who do not receive email or whose email addresses are not registered with the Company/ Depository Participant(s) may generate login credentials by following instructions given in the Notes to Notice of the AGM. The same login credentials may also be used for attending the AGM through VC/OAVM. Manner of registering / updating email addresses:

(a) Members holding shares in physical mode, who don't have registered/updated their email addresses with the Company, are requested to send the scanned copy of the following documents by email to the Company at cs@oswalagromills.com:

(i) A signed request letter mentioned their name, folio no. share certificate number, complete address, email id and mobile number; and

Scanned copy of Self-attested PAN card. (b) Members holding shares in dematerialised mode, who have not registered/ updated their email id with Depository

Participant(s), are requested to register/update their email id with their relevant Depository Participant(s). The Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Thursday, September 22,

2022 to Wednesday, September 28, 2022 (both days inclusive)

for annual closing and determining the entitlement of the Members, if any, Members are requested to carefully read all the notes set out in the Notice of the AGM including the instructions for attending the AGM, manner of casting vote through remote e-voting/e-voting

during the AGM. Please write to the secretarial department of the

Company at cs@oswalagromills.com in respect of queries

For Oswal Agro Mills Limited

Place: New Delhi Date: August 31, 2022

regarding aforesaid.

Anjali Aggarwal Company Secretary

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contants. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals adversing in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

DR. M. INDUSCORP LIMITED

Regd. Office: 18B/1, Ground Floor, Dev Nagar, D.B. Gupta Road, Karol Bagh, New Delhi-110005, Tel.: +91-11-28716806 CIN: L01119DL1986PLC023698 Nebsite: www.drminduscorp.com; Email: drmsoy@gmail.com

Notice is hereby given that:

- The 36th Annual General Meeting of the Company will be held on Tuesday, 27:09:2022 at 11:00 A.M. at 188/1, Ground Floor, D.B. Gupta Road, Dev Nagar, Karol Bagh, Delhi-110005, to transact the business as set out in the notice of the meeting dated 31.08.2022. The Notice along with the Annual Report for the year 2021-22, will be sent by electronic
- mode only to those members whose empil addresses are registered with the Company Depository Participant(s) on 31.08.2022 The notice of Annual General Meeting can be viewed/ downloaded from the CDSL website www.evotingindia.com. Physical copy of the same is available for inspection,
- during 10:00 A.M. to 12:00 Noon at the registered office of the company Pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations*), the register of members and share transfer books of the Company shall remain closed from 23.09.2022 to 27.09.2022 (both days inclusive), for the said Annua
- Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended by the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulations 44 of the Listing Regulation, the Company is pleased to provide e-voting facility by Central Depository Services Limited (CDSL) to its members in respect of the business(es)
- to be transacted at the Annual General Meeting. The e-voting facility will be available from 24 09 2022, 09:00 A.M. to 26:09:2022, 05:00 P.M. after which e-voting shall not be allowed.
- The out-off date for determining the eligibility to vote through electronic means or at the AGM is 22.09.2022
- Any person, who acquire shares of the company and become member of company after dispatch of the Notice of AGM and holding shares as of out-off date, may obtain the login ID and password by sending a request at helpdesk excling@cdslindia.com. However, if you are already registered with CDSL for remote e-voting then you can use you existing user ID and password for casting your vote.
- Facility for voting through polling paper shall be available at the AGM. Members who have already cast their vote through remote e-voting prior to AGM may also attend the AGM but shall not be entitled to cast their vote at the AGM.
- In case of any queries or issues regarding e-voting, please refer to the Frequently Asked Questions (FAQs) for Members and e-voting user manual for Members, available at www.evotingindia.com or write an e-mail to helpdesk.evoting@cdslindia.com.o contact Mr. Rakesh Dalvi, Deputy Manager at CDSL, A Wing, 25th Floor, Marathor Futurex, Mafatlai Mill Compounds, N.M. Joshi Marg, Lower Parel (East), Mumbai 400013, or at 1800-22-5533 or registered office address of the Company

For Dr. M. Induscorp Limited Prem Prakash Managing Director

DIN: 00289179

Place: New Delhi

VAM HOLDINGS LIMITED

(CIN: U51909UP1996PLC057371) Registered Office: Plot No. 1A, Sector - 16 A, Noida-201 301 (U.P.) E-mail: corporate.enpro@jepl.com, Phone: 0120-4361000 NOTICE OF THE 25" ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

This is in continuation to our earlier communication dated August, 26, 2022, whereby Members of VAM Holdings Limited ("Company") were informed that in compliance with the provisions of the Companies Act, 2013 ("Act") and Rules framed there under read with various circulars issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars"), the Board of Directors decided to convene the 25th Annual General Meeting ("AGM") of the Company on Wednesday, September 28, 2022 at 11:00 A.M. IST through Video Conferencing ("VC")/ Other Audio Visual Means ("OAVM") facility, without the physical presence of the Members at a common venue, to transact the business as set out in the Notice of 25th AGM. The Notice of 25th AGM and Annual Report of the Company for the financial year ended March 31, 2022 along with login details for joining the AGM through VC OAVM facility including e-voting has been sent on Tuesday, August 30, 2022 through e-mail to all those Members whose e-mail addresses are registered with the Company or Registrar and Share Transfer Agent or with their respective Depository Participants ("DP") in accordance with the MCA Circulars and through physical mode to those members whose email addresses are not registered with the Company/Depository Participants The Notice of 25th AGM is also available CDSL website www.evotingindia.com.

In compliance with the provisions of Section 108 of the Act read with the Companies (Management and Administration) Rules, 2014, and MCA Circulars, the Members will be provided with the facility to cast their vote electronically through the remote e-voting facility (prior to AGM) and e-voting facility (during the AGM) on all the resolutions set forth in the 25th AGM Notice. The facility of casting votes will be provided by CDSL. The remote e-voting shall commence on Saturday, September 24, 2022 (9.00 A.M. IST) and end on Tuesday, September 27, 2022 (5.00 P.M. IST). During this period, Members may cast their vote electronically. Thereafter, the remote e-voting module shall be disabled by CDSL for voting.

The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also participate in the AGM through VC / OAVM facility but shall not be entitled to cast their vote again through e-voting facility available during the AGM. Once the Member cast vote on a resolution, the Member shall not be allowed to change it subsequently. Detailed instructions for remote e-voting, joining the AGM and e-voting during the AGM is provided in the Notice of the 25" AGM.

A person, whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on Thursday, September 22, 2022 i.e. Cut-off date shall only be entitled to join the AGM, avail the remote e-voting and e-voting facility during the AGM. A person who ceases to be a Member as on Cut-off date should treat this Notice for information purposes only Any person, who acquire shares and become Member of the Company after the date of dispatch of the Notice of AGM and holding shares as on the Cut-off date, may obtain the Login ID and Password by following the instructions as mentioned in the Notice of AGM or sending a request at info@alankit.com. However, if he she is already registered with CDSL for remote e-voting, then he/she can use his / her existing User ID and password to cast their vote

If you have not registered your e-mail address with the Company/DP, you may please follow the below instructions for obtaining login details for e-voting:

Physical Please send a request to Alankit Assignments Limited, Registrar Holding and Share Transfer Agent at rta@alankit.com, providing your name, olio number, scanned copy of the share certificate (front and back). self-attested scanned copy of PAN card and self-attested scanned copy of Aadhar Card, Driving License, Election Card, Passport, Utility Bill or any other Government document in support of the address proof of the Member(s) as registered with the Company for registering the e-mail address and for obtaining login details for e-voting with a CC to corporate enpro@jepl.com

Please contact your DP and register your e-mail address in your Holding demat account, as per the process advised by your DP.

- The voting rights of Members shall be in proportion to their shares in the paid up equity share capital of the Company as on Thursday, September 22,
- The Scrutinizer will submit his report to the Chairman or to any other person authorized by him after the completion of the scrutiny of the e-voting (votes casted through e-Voting at the AGM and through remote e-voting), not later than 48 hours from the conclusion of the AGM. The result declared along with the Scrutinizer report shall be placed on the website of CDSL
- If you have any query relating to e-voting facility, please refer the Frequently Asked Questions (FAQs) and e-voting user manual for Shareholders available at the help section at www.evotingindia.com or contact at 022- 23058738 and 022-23058542/43 of CDSL or send a request to helpdesk.evoting@cdslindia.com. In case of any grievance connected with e-voting facility, please contact Mr. Rakesh Dalvi, Manager, (CDSL) Central Depository Services (India) Limited,'A' Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mills Compound, N M Joshi Marg, Lower Parel (E), Mumbai 400 013. Email: helpdesk.evoting@cdslindia.com, Tel: 022-23058738.

By order of the Board For VAM Holdings Limited Takesh Mathur

Director

DIN- 00009338

Place: Noida Date: September 01, 2022

SAYAJI HOTELS LIMITED

CIN: L51100TN1982PLC124332

Regd. Office: F1 C2 Sivavel Apartment, 2, Alagappa Nagar, Zamin Pallavaram, Chennai-600 117 (Tamil Nadu) Phone: 044-29871174 Email: cs@sayajigroup.com, Website: www.sayajihotels.com

Information Regarding 39th Annual General Meeting

The Thirty Ninth Annual General Meeting ("AGM") of the Members of the Company will be held through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") on Tuesday, 27" September, 2022 at 3:30 p.m. IST, in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015 read with all applicable circulars on the matter issued by the Ministry of Corporate Affairs ("MCA") and the Securities and Exchange Board of India ("SEBI"), to transact the business set out in the Notice Calling the AGM.

The Notice of the AGM and the standalone and consolidated audited financial statements for the financial year 2021-22, along with Board Report, Auditors' Report and other documents required to be attached thereof, will be sent to the members of the Company, electronically, whose e-mail address is registered with the Company / Depository Participant(s). The Notice of AGM and the aforesaid documents will also be available on the Company's website at www.sayajihotels.com and on the website of BSE Limited ("BSE") www.bseindia.com.

Manner of registering / updating e-mail address:

- (a) Members holding shares in physical mode and who have not updated their email addresses with the Company are requested to update their email addresses by writing to the Company at cs@sayajigroup.com along with the copy of the signed request letter mentioning the name and address of the Member, self-attested copy of the PAN Card, and self-attested copy of any document (eg.: Aadhaar, Driving License, Election Identity Card, Passport) in support of the address of the Member.
- (b) Members holding shares in dematerialised mode, who have not registered / updated their e-mail address, are requested to register/ update the same with the Depository Participant(s) where they maintain their demat accounts

Manner of casting vote(s) through e-voting:

Members can cast their vote(s) on the businesses as set out in the Notice of the AGM through electronic voting system ("e-voting"). The manner of voting, including voting remotely ("remote e-voting") by Members holding shares in dematerialized mode, physical mode and for Members who have not registered their e-mail address has been provided in the Notice of the AGM. Members attending the AGM who have not cast vote(s) by remote e-voting will be able to vote electronically during the AGM.

By the order of Board

Place : Chennai Date: 01.09.2022

Ankur Bindal Company Secretary and Compliance Officer ACS: 57859

CHEMCRUX ENTERPRISES LIMITED Regd. Off.: 330, TRIVIA Complex, Natubhai Circle, Racecourse, Vadodara-390007

Email: girishshah@chemcrux.com Ph.: 0265-2984803:2988903 Website: www.chemcrux.com (CIN: L01110GJ1996PLC029329)

NOTICE OF 26" ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE & E-VOTING INFORMATION NOTICE is hereby given that the Twenty Sixth (26th) Annual General Meeting of Members of CHEMCRUX ENTERPRISES LIMITED (Company) will be held on Friday 23rd September 2022 at 02:00 P.M. (IST). Pursuant to Circular Nos. 14/2020, 17/2020, 20/2020,02/2021 and 02/2022 dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021 and May 5, 2022 respectively, issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars"), the AGM is being held through Video Conference (VC)/ Other Audio Visual Means (DAVM) facility being provided by National Securities Depositories Limited (NSDL), to transact the business as set out in the notice of AGM. The instructions for joining the AGM electronically are provided in the

Pursuant to the MCA Circulars mentioned above and SEBI Circular dated May 12, 2020, January 15, 2021 and May 13, 2022 members may kindly note that the AGM Notice and Annual Report for the year ended 31st March, 2022was sent on 31st August 2022 electronically, only to such members whose Email Id is registered with the Company/ Company's RTA / Depositories / DPs. Those members who have not registered their E-mail Id may kindly register with their BPs or RTA Bigshare Services at www.bigshareonline.com.

Pursuant to section 91 of the Companies Act, 2013, the register of members and share transfer books of the Company will remain closed from 17th September 2022 to 23rd September 2022 (both days inclusive) for the purpose of AGM. The record date/cut off date for ascertaining the eligibility to receive final dividend, if declared at AGM will be as at the close of business on Friday, 16th September 2022. The dividend amount shall be directly credited into the registered bank account of the members within 30 days of declaration to shareholders whose name appear on the Register of members/ Register of beneficial owners as on the cut off date/ record date. Members may kindly check and register /update their bank details with their DPs. The Company will provide its members, facility of remote e-voting, through electronic voting services provided by NSDL for casting votes on all the business items as set out in the Notice of AGM. Members holding shares and recorded in register of members or in the register of beneficial owners maintained by depositories as on the cutoff date i.e., Friday, 16th September 2022, shall be entitled to e-voting. The remote e-voting shall commence on Tuesday, 20th September 2022 at 09.00 a.m. (IST) and end on Thursday, 22nd September 2022 at 05.00 p.m.(IST). The remote e-voting will be disabled thereafter. Facility for e-voting will also be provided at the AGM to only those members who attend the AGM through VC/BAVM and have not cast their vote. Any person who acquires shares of the Company and becomes member after dispatch of the AGM Notice and holding shares as on cutoff date may obtain the user ID and password by sending request to evoting@nsdl.co.in or if already registered with NSDL for

e-voting then existing user ID and password can be used for casting vote. The Company has appointed Mr. Kashyap Shah (Membership No.: F7862, COP No.: 6672), Proprietor of M/s. Kashyap Shah & Co., Practicing Company Secretaries, Vadodara to act as Scrutinizer for remote e-voting/e-voting at AGM. The result of voting will be announced within two working days of conclusion of AGM and be displayed on the Company's website at www.chemcrux.com, on website BSE Limited at www.bseindia.comand on website of NSDL at www.eveting.nsdl.com. The notice of the AGM along with Annual report will also is available at the website of the Company www.chemcrux.com,at the website of Stock Exchange www.bseindia.comand at the website of NSDL atwww.evoting.nsdl.com.

For e-voting instructions, members may go through the instructions given Notice and in case of any queries or grievances, members may refer the FAQs for shareholders and e-voting user manual for shareholders, available at the downloads section of www.evoting.nsdi.com or members may send request at evoting@nsdl.co.in or members may contact Ms. Sarita Mote on tell free nos.: 1800 1020 990 and 1800 22 44 30 and CDSL members may contact CDSL helpdesk by sending a request at helpdesk.evoting@cdslindia.com or contact at 022 23058738 or 022-23058542-43. For CHEMCRUX ENTERPRISES LIMITED Place: Vadodara Sd/- Dipika Rajpal

Date: 31" August, 2022 (Company Secretary)

ANSHUNI COMMERCIALS LIMITED CIN: L51900MH1984PLC034879

Regd office: Office No. CC 5041 / 5042, Tower C, Bharat Diamond Bourse,

E-mail: cslegal07@gmail.com, Website: http://www.anshuni.com/ NOTICE TO SHAREHOLDERS FOR 37TH ANNUAL GENERAL

Bandra Kurla Complex, Bandra (East) Mumbai, MH - 400 051, Tel No.: 99974 26815;

MEETING, BOOK CLOSURE & E-VOTING

(A) Annual General Meeting:

NOTICE is hereby given that the Thirty-Seventh (37th) Annual General Meeting of the 10:30 A.M. at CC 5041/5042, Tower C, Bharat Diamond Bourse, Bandra Kurla Complex, Bandra (East), Mumbai-400051 to transact the business set out in the notice of the AGM. (B) Book Closure:

Notice is further given pursuant to section 91 of the Companies Act, 2013 read with Rule 10 of Companies (Management and Administration) Rules, 2014, that the Register of Members and Share Transfer Book of the Company will remain closed from Saturday, the 17th day of September, 2022 to Friday, the 23rd day of September, 2022 (both days inclusive) for the

The notice of AGM along with the Statement annexed to the Notice pursuant to Section 102 of the Companies Act, 2013 and Annual Report of the Company for the year ended 31.03.2022 has been sent to the Members at their postal addresses or e-mailed at e-mail addresses registered with the Company/the depository participant/the registered and Share Transfer Agent (R&T Agent), as the case may be. The aforesaid documents are also available on the website of the Company viz http://www.anshuni.com/

In Compliance with the provisions of section 108 of the Companies Act, 2013 and Rule 20 of the Companies (Management and Administrations) Rules, 2014, as amended from time to time and Regulation 44 of the SEBI (Listing Obligations And Disclosures Requirement) Regulation, 2015, the Company is pleased to provide its Member facility to cast their vote electronically from a place other than the venue of the AGM (remote e-voting) on all resolutions set forth in the Notice, for which the Company has engaged the services of the Central Depository Services (India) Limited (CDSL) as e-voting agency The remote e-voting facility shall commences on Tuesday 20th September, 2022 at 9:00 a.m.

and ends on Thursday 22nd September, 2022 at 5:00 p.m. During this period Shareholders' of the Company may cast their vote electronically on the items mentioned in the Notice of AGM. The e-voting module shall be disable for voting thereafter. Once the vote on a Resolution is cast by the Shareholder, the Shareholder shall not be allowed to change it subsequently. A person whose name appears on the Register of Members/Beneficial Owners as on the cut off i.e. date 16th September, 2022 only shall be entitled to avail the facility of remote e-voting

as well as voting at the Meeting. Any person who becomes Member of the Company after dispatch of the Notice and holding shares as on cutoff date may obtain the User Id and Passwords by sending a request at helpdesk.evoting@cdslindia.com The Members, who have not cast their vote either through remote e-voting, can exercise their voting rights at the AGM. The Company will make necessary arrangement in this regard at the AGM Venue and shall be able to vote at the Meeting through polling paper.

Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM, however those Members shall not be entitled to cast their vote again at the AGM. The detailed procedure for obtaining User Id and Password are also provided in the Notice of the Meeting which is available at Company's website and CDSL's website. If the Member is already registered with CDSL for e-voting then he can use the existing User Id and Password for casting the vote through e-voting In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently

Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk evoting@cdslindia.com The result of e-voting shall be announced on or after the AGM of the Company. The results declared along with Scrutinizer's Report shall be placed on the Company's website http://www.anshuni.com/ and on the website of CDSL www.cdslindia.com for information of

the members, being communicated to the Stock Exchanges A MEMBER ENTITLED TO ATTEND AND TO VOTE AT THE MEETING IS ALSO ENTITLED TO APPOINT A PROXY TO ATTEND AND VOTE INSTEAD OF HIMSELF / HERSELF AND SUCH PROXY NEED NOT BE A MEMBER OF THE COMPANY. The Instrument appointing the Proxy / Proxies, in order to be valid and effective, should be deposited at the Registered

Office of the Company not less than 48 hours before the commencement of the AGM. By Order of the Board of Director For ANSHUNI COMMERCIALS LIMITED

PRIYESH GARG

Place: Mumbai

DIN: 07636054

PHF LEASING LIMITED Corp. Office: 87, Radio Colony, Mahavir Marg, BMC Chowk, Jalandhar - 144001, Punjab CIN No. L65110PB1992PLC012488, Ph.No.0181-4639903-04. Website: www.phfleasing.com, Email id: phf_leasingltd@yahoo.co.in

NOTICE OF 30™ ANNUAL GENERAL MEETING Notice is hereby given that the 30" Annual General Meeting (AGM) of PHF Leasing Limited

is scheduled to be held on Friday, September 23, 2022 at 11:30 A.M. IST through Video Conferencing (VC)/ Other Audio Visual Means (OAVM) in compliance with the Circulars Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May 05, 2020,02/2021 dated January 13, 2021, 19/2021 dated December 8, 2021 and 21/2021 dated Decemer 14, 2021 and 02/2022 dated May 05, 2022 and all other applicable laws and circulars issued by the Ministry of Corporate Affairs (collectively referred as "MCA Circulars") to transact the ordinary business and unavoidable special business set forth in the Notice of the AGM dated August 12, 2022.

In compliance with the above said Circulars and SEBI Circular dated May 13, 2022, AGM Notice along with the Annual Report for the Financial Year 2021-2022, has been sent via email to those members whose names appeared in the Register of Members/ Beneficial Owner in the register maintained by the Company or Registrar (Skyline Financial Services) Private Limited) on Friday, August 26, 2022.

AGM Notice is also available at the Company's website at www.phfleasing.com and on the website of NSDL i.e. www.evoting.nsdl.com.

Manner of registering/updating e-mail address to cast vote through e-voting Further, members holding shares in dematerialized mode, are requested to register their email addresses and mobile numbers with their relevant depositories through their depository participants. However, for temporary registration for the purpose of obtaining this notice, shareholders may register their email ids with the Company by writing to Ms. Shikha Kapoor, Company Secretary of the Company, at her email id shikha@phfleasing.com

Members holding shares in physical mode are requested to register their email ids with the Company by writing to Ms. Shikha Kapoor, Company Secretary at the email ID shikha@phfleasing.com or to Registrar & Share Transfer Agent M/s Skyline Financial Services Private Limited at the e-mail ID admin@skylinerta.com by quoting your Folio No., PAN, Mobile No., Email-Id along with a self-attested copy of your PAN Card / Aadhar Card and Share Certificate (front and back). Remote e-voting and voting during AGM

The Company is also providing facility to its members to cast their vote remotely on the business as set forth in the Notice of the AGM through electronic voting system. The manner

of e-voting is defined as below: 1. A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date i.e. Friday, September 16, 2022, shall only be entitled to avail the facility of remote e-Voting The remote e-voting period commences on Tuesday, September 20, 2022 (9:00 a.m. IST) and ends on Thursday, September 22, 2022 (5:00 p.m. IST). The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter. Once the vote on a resolution is cast by the

Member, he/she shall not be allowed to change it subsequently or cast the vote again. Any person who acquires shares of the Company and becomes the member of the Company after sending of this Notice and holding shares as on the cut-off date, may obtain the log in id and password by sending a request at shikha@phfleasing.com or or admin@skylinerta.com. However, if he ishe is already registered with NSDL for remote evoting then he/she can use his /her existing user id and password.

 The procedure for e-Voting on the day of the AGM is same as the instructions mentioned for Remote e-voting in the notice.

5. Only those members, who are present in the AGM through VC/OAVM facility and have not casted their vote on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system available during the AGM. Shareholders who have voted through remote e-voting will be eligible to attend the AGM. However, they will not be eligible to vote at the AGM.

For detailed instructions relating to attending the meeting through VC or OVAM, please refer

If you have any queries or issues regarding attending AGM & e-Voting from the e-Voting System, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to evoting@nsdl.co.in or call at toll free no.: 1800 1020 990 and 1800 22 44 30. For PHF Leasing Limited

Place: Jalandhar Date: August 30, 2022

Shikha Kapoor Company Secretary, M.No. A19146 FRANKLIN LEASING & FINANCE LIMITED

Regd. Off.: Unit/Shop No.205, Second Floor, Aggarwal City Mail Road No 44, Pita mpura North Delhi-110034

Email ID.: franktinlessingfinance@gmail.com CIN: U74899DL1992PLC048028 NOTICE OF 30th ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING

INFORMATION AND BOOK CLOSURE The notice is hereby given that: . The 30th Annual General Meeting (AGM) of the Company will be held at Unit/Shop No 205, Second Floor, Aggarwal City Mall Road No.44, Priampura Delhi North Delhi 110034 on Saturday, 24th September, 2022 at 01:30 PM to transact the Ordinary and

Special Business, assertoutin the Notice of AGM; Electronics Copies of the Notice of AGM and Annual Report for 2021-22 have been sent to all members whose email IDs are legistered with the Depository Participants. The same is also available on the Company's Website- www.franklinleasing.in The

dispatch of Notice of AGM has been completed on 01st. September, 2022. . Members holdings have seither in physical form or in dematerialized form, as on the out-off date of 17th September, 2022, may cast their vote electronically on the Ordinary and Special Business as set out in the Notice of AGM through electronics

voting system of Central Depository Services Limited (CDSL) from a place other than venue of AGM ("remote e-voting"). All the members are informed that: The Ordinary and the Special Business as set out in the Notice of AGM may be

 The remotee-voting shall commence on Wednesday, 21st September, 2022 at 10:00 A.M. IST

transacted through voting by electronics means:

 The lemote e-voting shall end on Friday, 23th September, 2022 at 5:00 P.M. IST iv. The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGMis Saturday, 17th September, 2021. Any person, who acquire shares of the Company and become member of Company

Saturday, 17th September, 2022, may obtain the login ID and password by sendinga, request at evoling@cdsl.co.in. However, if person is already legistered with CDSL for e-voting then existing user ID and password can be used for casting Members may note that: a) the remote e-voting modules hall be disabled by CDSL after the aforesaid date and time for voling and once the vote on a resolution is cast by the members , the member shall not be allowed to change it subsequently; b) the facility for voting through ballot papers hall be made available at the AGM; and of

after dispatch of the Notice of AGM and holding shares as of cut-off date i.e

the member may participate in the general meeting even after exercising his light to vote through remote e-voting but shall not be allowed to vote again in the meeting; and d) a person whose name is recorded in the register of members or in the register of be religial members maintained by the depositories as on the gut-of date only shall be entitled to avail the facility of remote e-voting or voting at the AGN through ballot paper; vii. The Notice of AGM is available on the Company's website-www.frankinteasing.in and viii. In case of queries, members may refer to the Frequently Asked Questions (FAQs) for members and e-voting user manual for members at the Downloads Section of

https://www.evoting.adsl.com.or.callion.toll.free.number.1802005533.or.a.11he designated email ID: helpdes kievoting@cdstindia.com, who will address the grievances connected with the electronic voting. Members may also write to the Company Secretary at the above mentioned email ID or the Registered Office

BOOK CLOSURE

The Register of Members and the Share Transfer books of the Company will remain dosedfrom Sunday, 18th September, 2022 to Saturday, 24th September, 2022 (both days

For Franklin Leasing & Finance Ltd

Place: Delhi

Date: 31st August, 2022

Rashmi Bhagat Company Secretary Membership No. 54366



RADICO KHAITAN LIMITED

CIN: L26941UP1983PLC027278 Registered Office: Bareilly Road, Rampur - 244 901 (U.P.) Tel. No.: 0595-2350601/2, 0595-2351703 Fax No.: 0595-2350009 Email ID: investor@radico.co.in, Website: www.radicokhaitan.com INFORMATION REGARDING 38TH ANNUAL GENERAL MEETING.

BOOK CLOSURE AND FINAL DIVIDEND Shareholders may note that the 38th Annual General Meeting ("AGM") of the Company will be held on Thursday, September 29, 2022 at 01:00 P.M. (IST) at the Registered Office of the Company a Rampur Distillery, Bareilly Road, Rampur - 244 901 (U.P.), to transact

the business that will be set forth in the Notice of the AGM. In compliance with the Circular No. 20/2020 dated May 05, 2020 issued by the Ministry of Corporate Affairs ("MCA") and Circula No. SEBVHO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 issued by the Securities and Exchange Board of India ("SEBI") and all other Circulars issued by MCA and SEBI in this regard, from time to time electronic copies of the Notice of AGM and Annual Report for the Financial Year 2021-22 will be sent to all the shareholders whose email IDs are registered with the Company/Depository Participant(s) The Notice of the AGM is also available on the website of the Company www.radicokhaitan.com, websites of the Stock Exchanges i.e BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com and the website of

KFin Technologies Limited at https://evoting.kfintech.com. Members holding shares in dematerialised mode, who have no registered/ updated their E-mail addresses, are requested to register their E-mail addresses and mobile numbers with their relevan depositories through their depository participants. Members holding shares in physical mode, who have not registered/ updated their E-mail addresses, are requested to furnish email addresses and mobile numbers with the Company's RTA, KFin Technologies Limited ("KFintech"), Selenium Tower B, Plot No. 31 & 32, Gachibowli, Financia District, Nanakramguda, Serilimgampally, Hyderabad - 500032, Tol Free Tel: 1- 800-309-4001, Email: einward. ris@kfintech.com

Website: www.kfintech.com. Members will be provided with the facility to cast their votes electronically, through the remote e-voting facility (before the AGM) and through ballot papers (at the AGM), on all the resolutions set fort in the Notice of AGM. The facility of remote e-voting will be provided by KFintech. Members who will not cast their vote by remote e-voting prior to the AGM may cast their vote at the AGM through ballot paper Members who will cast their vote by remote e-Voting shall not be eligible to vote at the AGM. Detailed process and manner of remote e-voting, voting at the AGM and instructions for attending the AGM is

being provided in the AGM Notice. The remote e-voting period commences on Sunday, September 25, 2022 at 9:00 a.m. (IST) and ends on Wednesday, September 28, 2022 at 5:00 p.m. (IST). The remote e-voting module shall be disabled by KFintech for voting thereafter. During the remote e-voting period, Members holding shares in either physical mode or i dematerialized mode, as on the cut-off date i.e. Thursday, September 22, 2022, may cast their vote electronically as per the process detailed

in the Notice of AGM. Share holders may note that the Board of Directors at their meeting held on Monday, May 30, 2022 has recommended a final dividend of Rs. 3 per share @ 150%. The record date for the purpose of fina dividend is Thursday, September 22, 2022. The final dividend, once approved by the shareholders at the ensuing AGM, will be paid on o

before Friday, October 28, 2022. The Company has fixed Book Closure dates from Friday, September 23, 2022 to Thursday, September 29, 2022 (both days inclusive) to

payment of dividend for the Financial Year 2021-22. Dividend will be paid, preferably through National Electronic Clearing Service ('NECS'), wherever such facility is available, under intimation to the members. In case dividend cannot be paid through NECS, it w

be paid through dividend warrants/ demand drafts. In cases where the payments to the members holding shares in dematerialized form are made by dividend warrants, particulars of bank account registered with their Depository Participants will be considered by the Company for printing the same on dividend warrant For those members who have not provided NECS details/ bank account details, the Company shall print the registered address of the members on the dividend warrant

Members are requested to intimate change, if any, in their address (with PIN Code), E-mail ID, nominations, bank details, mandate instructions, NECS mandates, etc. under the signature of the registered

the Company's RTA in respect of the shares held in physical form; and

 the Depository Participants in respect of shares held in dematerialised form In terms of the provisions of the Income Tax Act, 1961, ('IT Act' dividend income will be taxable in the hands of the Members and the Company is required to deduct tax at source at the prescribed rate from the dividend paid. The deduction of tax at source will be based or the residential status and classification of Members, documents submitted and accepted by the Company. The Members are therefore, requested to submit requisite tax related documents/ declarations to the Company RTA on or before Thursday, September 22, 2022 to enable the Company to determine the appropriate withholding tax rate applicable

 Members are requested to carefully read all the Notes set out in the Notice of AGM and in particular, instructions for casting vote through remote e-voting and voting at the AGM.

Place: New Delhi

Date : 31.08.2022

By Order of the Board Dinesh Kumar Gupta

Vice President - Legal & Company Secretary

Ahmedabad

financialexp.epapr.in

SAYAJI HOTELS LIMITED

CIN: L51100TN1982PLC124332 Regd. Office: F1 C2 Sivavel Apartment, 2, Alagappa Nagar, Zamin Pallavaram, Chennai-600 117 (Tamil Nadu) Phone: 044-29871174 Email: cs@sayajigroup.com, Website: www.sayajihotels.com

Information Regarding 39th Annual General Meeting

The Thirty Ninth Annual General Meeting ("AGM") of the Members of the Company will be held through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") on Tuesday, 27th September, 2022 at 3:30 p.m. IST, in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015 read with all applicable circulars on the matter issued by the Ministry of Corporate Affairs ("MCA") and the Securities and Exchange Board of India ("SEBI"), to transact the business set out in the Notice Calling the AGM.

The Notice of the AGM and the standalone and consolidated audited financial statements for the financial year 2021-22, along with Board Report, Auditors' Report and other documents required to be attached thereof, will be sent to the members of the Company, electronically, whose e-mail address is registered with the Company / Depository Participant(s). The Notice of AGM and the aforesaid documents will also be available on the Company's website at www.sayajihotels.com and on the website of BSE Limited ("BSE") www.bseindia.com.

Manner of registering / updating e-mail address:

(a) Members holding shares in physical mode and who have not updated their email addresses with the Company are requested to update their email addresses by writing to the Company at cs@sayajigroup.com along with the copy of the signed request letter mentioning the name and address of the Member, self-attested copy of the PAN Card, and self-attested copy of any document (eq. Aadhaar, Driving License, Election Identity Card, Passport) in support of the address of the Member.

(b) Members holding shares in dematerialised mode, who have not registered / updated their e-mail address, are requested to register/ update the same with the Depository Participant(s) where they maintain their demat accounts.

Manner of casting vote(s) through e-voting:

Members can cast their vote(s) on the businesses as set out in the Notice of the AGM through electronic voting system ("e-voting"). The manner of voting, including voting remotely ("remote e-voting") by Members holding shares in dematerialized mode, physical mode and for Members who have not registered their e-mail address has been provided in the Notice of the AGM. Members attending the AGM who have not cast vote(s) by remote e-voting will be able to vote electronically during the AGM.

By the order of Board

Place : Chennai Date : 01.09.2022

Ankur Bindal Company Secretary and Compliance Officer ACS: 57859

કેમકક્ષ એન્ટરપ્રાઇઝીઝ લિમિટેડ

રિજ.ઓફિસ : ૩૩૦, ટ્રિવિચા કોમ્પ્લેક્ષ, નટુભાઇ સર્કલ, રેસકોર્સ, વડોદરા-૩૯૦૦૦૭ ઇમેઇલ : girishshah@chemcrux.com ફ્રોનઃ 0265-2984803/2988903 વેબસાઇટઃ www.chemcrux.com (સીઆઇએન : એલ૦૧૧૧૦જીજે૧૯૯૬પીએલસી૦૨૯૩૨૯)

ર૬મી વાર્ષિક જનરલ મીટીંગ નોટિસ, બુક ક્લોઝર અને ઇ-વોટિંગ માહિતી આ નોટિસ અન્વયે સૂચિત કરવામાં આવે છે કે કેમકક્ષ એન્ટરપ્રાઈઝીઝ લિમિટેડ (કંપની)ના સભ્યોની રકમી વાર્ષિક જનરલ

મીટીંગ શુક્રવારે તા. ર3મી સપ્ટેમ્બરે ૨૦૨૨ ના રોજ બપોરે ૨.૦૦ કલાકે યોજવામાં આવેલ છે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ ક્રારા ૧૩ એપ્રિલ ૨૦૨૦, ૦૮ એપ્રિલ ૨૦૨૦, ૦૫ મે ૨૦૨૦, ૧૩મી જાન્યુઆરી ૨૦૨૧ અને ૫ મે ૨૦૨૨ બહાર પાડવામ આવેલ પરિપત્ર ક્રમાંક ૧૪/૨૦૨૦, ૧७/૨૦૨૦, ૨૦/૨૦૨૦, ૦૨/૨૦૨૧ અને ૦૨/૨૦૨૨ અનુસાર એ.જા.એમ નોટિસમાં દર્શાવ્યા મુજબ વેપારના વ્યવहાર માટે નેશનલ સિક્યુરિટીઝ કિપોઝિટરી પ્રાઇવેટ લિમિટેક (એનએસડીએલ) દ્વાર આપવામાં આવેલ વિડીચો કોન્ફરન્સ (વી.સી.) અથવા અધર ઓડિચો વિડિચો મીન્સ (ઓએવીએમ)ના માધ્યમ દ્વાર એ. જી.એમ. ચોજવામાં આવેલ છે. એ. જી.એમ.માં જોડાવા માટેની સૂચનાઓ એ. જી.એમ. ના નોટિસમાં જણાવેલ છે. ઉપર જણાવેલ એમસીએ ના પરિપત્ર તેમજ સેબી દ્વારા આપવામાં આવેલ ૧૨મી મે ૨૦૨૦, ૧૫મી જાન્યુઆરી ૨૦૨૧ અને ૧૩મી મે ર૦૨૨ ના રોજના પરિપત્ર અન્વચે સભ્યોનું ધ્યાન દોરવામાં આવે છે કે એ. જી.એમ, નોટિસ તેમજ 3૧ માર્ચ ૨૦૨૨ ના રોજ સમાપ્ત થયેલ વર્ષનો વાર્ષિક રિપોર્ટ ૩૧મી ઓગષ્ટ ૨૦૨૨ ફક્ત એવા સભ્યોને ઇલેક્ટ્રોનીકલી મોકલવામાં આવેલ છે જેઓના ઇ-મેલ આઇડી કંપની/કંપનીના રજીસ્ટ્રાર / કિપોઝીટરીઝ/કી.પી.માં નોંધાવેલ છે. એવા સભ્યો કે જેઓએ તેઓના ઇ-મેલ આઇડી નોંધાવેલ નથી તે ઓને ડી.પી. અથવા આર.ટીએ. બિગશેર સર્વિસીસ www.bigshareonline.com પર નોંધણ કરાવવા વિનંતી છે. કંપની એક્ટ ૨૦૧૩ ની કલમ ૯૧ મુજબ એ.જી.એમ. માટે સભ્યોના ૨જીસ્ટર અને કંપનીના શેર ટ્રાન્સકર બુક્સ ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૨ થી ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૨ (બંને દિવસ ગાણીને) સુધી બંધ રાખવામાં આવશે. અંતિમ ફેવિડન્ડ મેળવવાની ખાતરી કરવાની રેકોર્ડ ડેટ જો એ.જી.એમ.માં જાહેર કરવામાં આવે તો તે શુક્રવારે ૧૬મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના વેપાર બંધ કરવાના સમયે નક્કી કરેલ મુજબની રહેશે. ડિવિકન્ડની રકમ સભ્યોના રજિસ્ટર્ડ બેંક ખાતામાં ઘોષણાના ૩૦ દિવસની અંદર સીધા જ શેર ધારકોને જમા કરવામાં આવશે કે જેમનું નામ કટ ઓફ કેટ/રેકોર્ડ તારીખે સભ્યોના રજિસ્ટર/બેનિકિશિયરી ઓનરના રજીસ્ટરમાં દેખાય છે. સભ્યોને તેઓની બેંકની માહિતી ડી.પી. સાથે તપાસ અને નોંધણી/સુધારો કરવા વિનંતી છે. નોટિસમાં જણાવ્યા મુજબ વેપારની વસ્તુઓ અન્વચે પોતાના મત આપવા મો એન.એસ.ડી.એલ. દ્વારા આપવામાં આવે એટલે ઇલેક્ટ્રોનિંક વોર્ટિંગ દ્વારા રીમોટ ઇ-વોર્ટિંગની સુવિધા કંપની દ્વારા તેન સભ્યોને આપવામાં આવશે. એવા તમામ સભ્યો કે જેઓ શેર ધરાવે છે અને સભ્યોના રજાસ્ટરમાં અથવા ડિપોઝીટરીઝ દ્વાર જાળવવામાં આવેલ બેનિફિશિયરી ઓનરના રજીસ્ટરમાં શુક્રવારે ૧૬મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ પહેલાં નોંધાયેલ હોય તેએ ૪ ઇ-વોર્ટિગ માટેના હક્કદાર છે. રીમોટ ઇ-વોર્ટિંગ મંગળવારે ૨૦મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સવારના oe.oo કલાકે શ થશે અને ગુરવારે રુસ્મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સાંજના ૦૫.૦૦ કલાકે બંધ થશે. ત્યારબાદ રીમોટ ઇ-વોર્ટિંગ બંધ કરે દેવામાં આવશે. એ.જી.એમ. દરમિયાન એવા જ સભ્યોને વોટીંગ કરવા દેવામાં આવશે જેમણે વી.સી./ ઓ.એ.વી.એમ મારફતે એ.જી.એમ.માં ભાગ લીધેલ હશે અને તેઓનો મત આપેલ નહીં હોય. કોઇપણ વ્યક્તિ કે જે કંપનીના શેર ધરાવે છે એએ એ.જી.એમ.બી નીટિસ મોકલવા બાદ સભ્ય બનેલ હોય અને કટ એકિ ના દિવસે શેર ધરાવલા હોય તો તેઓને અએ એ.જી.એમ.બી નીટિસ મોકલવા બાદ સભ્ય બનેલ હોય અને કટ એકિ ના દિવસે શેર ધરાવલા હોય તો તેઓને evoting@nsdl.co.in પર રિક્વેસ્ટ મોકલીને પોતાનું યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવા વિનંતી છે અથવા જો એન.એસ.ડી.એલ. માં ઇ-વોટિંગ મોટે નોંધાયેલ હોય તો તેમના હાલના યુઝર આઇડી અને પાસવર્ડ મત આપવા માટે ઉપયોગમાં લઇ શકાશે. કંપનીએ કશ્યપ શાહ એન્ડ કંપની, પ્રેક્ટિરીંગ કંપની સેક્ટરીસ, વડોદરાના માલિક શ્રી કશ્યપ શાહ (સભ્ય નં. ७૬૬૨, સી.પી.નં. ૬૬७૨) ને એ.જી.એમ. રીમોટ ઇ-વોરિંગ/ઇ-વોરિંગનું સંચાલન ન્યાય અને પારદર્શક રીતે થાયે તે માટે સ્ક્રિટિનાઇઝર તરીકે નિયુક્ત કર્યો છે. વોટિંગનું પરિણામ એ.જી.એમ.ના સમાપનના બે કામકાજના દિવસોમ જાહેર કરવામાં આવશે અને કંપનીની વેબસાઇટ www.chemcrux.com પર, બી.એસ.ઇ. લિમિટેડની વેબસાઇટ ww.bseindia.com પર અને એન.એસ.ડી.એલ.ની વેબસાઇટ www.evoting.nsdl.com પર મુકવામાં આવશે. એ.જી.એમ. નોટિસ અને વાર્ષિક રિપોર્ટ કંપનીના વેબસાઇ www.chemcrux.com પર. સ્ટોક એક્સચેન્જની વેબસાઇ dia com અને એનએસડીએલ ની વેબસાઇટ www.evoting.nsdl.com પર ઉપલબ્ધ છે. ઇ-વોરિંગન સૂચનાઓ માટે સભ્યો નોટિસમાં આપેલી સૂચનાઓ માંથી પસાર થઇ શકે છે અને કોઇપણ પ્રશ્નો અથવા ફરિયાદોન કિસ્સામાં સભ્યો શેરધારકો માટે વારંવાર પુછાતા પ્રશ્નો (FAQs) અને શેરધારકો માટે ઇ-વોરિંગ વપરાશ કરતા માર્ગદર્શિકાને સંદર્ભ લઇ શકે છે જે www.evoting.nsdl.com ડાઉનલોડ વિભાગ પર ઉપલબ્ધ છે અથવા evoting@nsdl.co.in પર વિનંતી કરી શકે છે અથવા સભ્યો કુમારી સરિતા મોટે ને ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ અને ૧૮૦૦ ૨૨૪ ૪૩૦ પર સંપર્ક કરી શકે છે અને સી.ડી.એસ.એલ. ના સભ્યો સી.ડી.એસ.એલ. સહાય ડેસ્ક પર સંપર્ક કરી શકે છે. ઈ-મેલ : 🛭 પા વિનંતી મોકલીને અથવા ટોલ કી નં. ૦૨૨-૨૩૦૫૮७૩૮/૦૨૨-૨૩૦૫૮૫૪૨-૪૩ પર કોન કરીને સંપર્ક કરી શકે છે. કેમક્સ એન્ટરપ્રાઇઝીઝ લિમિટેડ વર્તી સ્થળ : વડોદરા

તારીખ : ૩૧-૦૮-૨૦૨૨

સઠી /-દિપીકા રાજપાલ (કંપની સેક્રેટરી)

FRANKLIN LEASING & FINANCE LIMITED Regd. Off.: Unit/Shop No.205,Second Floor,Aggarwal City Mall Road No.44.Pitampura North Delhi-110034 Email ID.: franklinleasingfinance@gmail.com CIN: U74899DL1992PLC048028

NOTICE OF 30th ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE

The 30th Annual General Meeting ('AGM') of the Company will be held at Unit/Shop No.205, Second Floor, Aggarwal City Mall Road No.44, Pitampura Delhi North Delhi 110034 on Saturday, 24th September, 2022 at 01:30 PM to transact the Ordinary and Special Business, as set out in the Notice of AGM; Electronics Copies of the Notice of AGM and Annual Report for 2021-22 have been

sent to all members whose email IDs are registered with the Depository Participants. The same is also available on the Company's Website- www.franklinleasing.in The dispatch of Notice of AGM has been completed on 01st September, 2022.

Members holding shares either in physical form or in dematerialized form, as on the

cut-off date of 17th September, 2022, may cast their vote electronically on the Ordinary and Special Business as set out in the Notice of AGM through electronic voting system of Central Depository Services Limited (CDSL) from a place other than venue of AGM ("remote e-voting"). All the members are informed that:

The Ordinary and the Special Business as set out in the Notice of AGM may be transacted through voting by electronics means: The remote e-voting shall commence on Wednesday, 21st September, 2022 a

10:00 A.M. IST iii. The remote e-voting shall end on Friday, 23th September, 2022 at 5:00 P.M. IST

iv. The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is Saturday, 17th September, 2021.

Any person, who acquire shares of the Company and become member of Compan after dispatch of the Notice of AGM and holding shares as of cut-off date i.e. Saturday, 17th September, 2022, may obtain the login ID and password by sending a request at evoting@cdsl.co.in. However, if person is already registered with CDSL for e-voting then existing user ID and password can be used for casting $\frac{1}{2}$

vi. Members may note that: a) the remote e-voting module shall be disabled by CDSI after the aforesaid date and time for voting and once the vote on a resolution is case by the members, the member shall not be allowed to change it subsequently; b) the facility for voting through ballot paper shall be made available at the AGM; and c the member may participate in the general meeting even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the meeting and d) a person whose name is recorded in the register of members or in the register of beneficial members maintained by the depositories as on the cut-of date only shall be entitled to avail the facility of remote e-voting or voting at the AGM

vii. The Notice of AGM is available on the Company's website-www.franklinleasing.in and viii. In case of queries, members may refer to the Frequently Asked Questions (FAQs for members and e-voting user manual for members at the Downloads Section o https://www.evoting.cdsl.com or call on toll free number 1802005533 or at the designated email ID: helpdesk.evoting@cdslindia.com, who will address the grievances connected with the electronic voting. Members may also write to the Company Secretary at the above mentioned email ID or the Registered Office

BOOK CLOSURE The Register of Members and the Share Transfer books of the Company will remain

closed from Sunday, 18th September, 2022 to Saturday, 24th September, 2022 (both days For Franklin Leasing & Finance Ltd

ate: 31st August, 2022

Rashmi Bhagat Company Secreta Membership No. 54366

उत्तर प्रदेश सहकारी चीनी मिल्स संघ लिमिटेड 9-ए, राणा प्रताप मार्ग, लखनऊ-226001 **Tel No. (0522) 2628310, 2283121**

E-TENDER NOTICE

Online short term e-tenders are invited from manufacturers and BIS certificate older (as per details given in tender documents) on Conversion based supply for HDPE/PP BAGS 50 Kg to our various Cooperative Sugar Factories of U.P. The e-tender documents with detailed specifications, terms and conditions etc. can be downloaded from e-tender portal http://etender.up.nic.in & federation website www.upsugarfed.org. The Federation reserves the right to cancel any or all bids/annul e-bidding process without assigning any reason to & decision of Federation will be final & binding.

The tender document is available at e-Procurement website http://etender.up.nic.in or Federation's website www.upsugarfed.org from 30/08/2022 at 6:55 PM.. Interested bidders may view, download the e-Bid document, seek clarification and submit their e-Bid online up to the date and time mentioned in the tab.

(RAMAKANT PANDEY)
MANAGING DIRECTOR

સ્ટેટ બેંક ૧૦૨ કરોડ માટે અનામિકા કન્ડ્રકટર્સનું બેડ લોન એકાઉન્ટ વેચશે

પીટીઆઇ

નવી દિલ્હી, તા. ૩૧ બેંકરૂસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વસુલ કરવા માટે છે. અનામિકા કન્ડ્રક્ટર્સના નોન-

સપ્ટેમ્બરના અંતમાં ઇ- બાકી રકમ ભરવાની થાય છે.

બિડિંગ મારફત વેચશે, જે રૂ રિઝર્વ બેંકે ઇ-ઓક્શન જે કે સ્ટ્રેસ્ડ લોન એક્સપોઝર્સની દેશની સૌથી મોટી ધિરાણ પિયા ૧૦૨ કરોડનું લ્હેણું ૨૮મી સપ્ટેમ્બર,૨૦૨૨ના ટ્રાન્સફર અંગે રોજ યોજાનાર છે તેના માટેના પોલિસીની શરતો અનામિકા ં અનામિકા કન્ડક્ટર્સે રૂ રિઝર્વભાવ રૂપિયા ૨૨.૧૩ કન્ડ્ક્ટર્સના લોન ખાતામાં પરફ્રોર્મિંગ લોન એકાઉન્ટને પિયા ૧૦૨.૩૦ કરોડની કરોડ મૂક્યા છે.

એસબીઆઇએ જણાવ્યું છે મૂકવામાં આવેલી છે, જે લાયક એઆરસીએસ-બેંકો-એનબીએફસી-

એફઆઇએસને ટ્રાન્સફર માટે છે. બેંકે, જો કે જણાવ્યું છે કે સૂચિત ટ્રાન્ઝેક્શન સાથે આગળ નવધવા કે તેની કોઇ ટર્મ્સ કંડિશન્સમાં કોઇપણ તબક્કે કોઇપણ સુધારા કરવાના તેના અધિકારને અબાધિત રાખે છે.

૧૯૮૮માં સ્થપાયેલી, અનામિકા કન્ડ્રકટર્સ એ જયેપુર સ્થિ કંપીનછે અને એલ્યુમિનિયમ એલ્યુમિનિમમ એલોય કન્ડક્ટર્સ અને પાવર કેબલના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. તે પવન ઊર્જા ઉત્પાદન સાથ પણ સંકળાયેલી છે અને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં તેની મિલો આવેલી છે.

કસ્ટમ્સ પાંચમી સપ્ટેમ્બરથી આયાતી ચીજોની એકસમાન તપાસ શરૂ કરશે

કસ્ટમ્સ વિભાગ ઇમ્પોર્ટેડ કન્સાઇનમેન્ટસના ક્લિયરન્સ માટે દેશભરમાં પાંચમી સપ્ટેમ્બરથી તબક્કાવાર સ્ટાન્ડર્ડાઇઝ્ડ રિસ્ક બેઝ્ડ ફેસલેસ આકારણી વ્યવસ્થા શરૂ કરશે, જેનો પ્રારંભ ધાતુથી કરવામાં આવશે. આને પગલે કસ્ટમ્સની તપાસમાં એકરૂપતા આવશે તથા કન્સાઇનમેન્ટસને ક્લિયર કરવામાં થતો સમય ઘટવાથી વ્યવસાય માટેની સાનુકૂળતાને ઉત્તેજન મળશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ

એન્ડ ટેક્સિસ (સીબીઆઇસી)એ ઓફિસોને પરિપત્રમાં જણાવ્યું હતું કે. નેશનલ કસ્ટમ્સ ટાર્ગેટિંગ સેન્ટર (એનસીટીસી)એ માપદંડોના આધારે બિલ્સ ઓફ એન્ટ્રી (બીઓઇ) માટે સિસ્ટમ જનરેટેડ સેન્ટલાઇઝડ એક્ઝામિનેશન ઓર્ડ્સ વિકસાવ્યા છે.

બહેર સૂચના

જાહેર જનતાને આથી જણાવવામાં આવે છે કે અમારા અસીલ, મે. મુધૂટ ફાયનાન્સ લિ. (GSTIN 32AABCT0343B1Z7), રજીસ્ટર્ડ ઓફિસ: રજો માળ, મુધૂટ રોમ્બર્સ, બેનર્જી રોડ, કોરી - 682018, કેરલા. ભારત. CIN: L65910KL1997PLC011300, ફોન: +91 484-2396478, 2394712, ફેક્સ: +91 484-2396506, mails@muthootgroup.com, www.muthootfinance.com નીચે આપવામાં આવેલી વિગતો અનુસાર, કરજની ચુકવણીમાં કસૂર કરનાર ૠણ લેનારાઓ દ્વારા, તેમની તરફેણમાં ગીરો મૂકવામાં આવેલા ઘરેણાઓની (02.07.2021 સુધીના સમયગાળાના NPA ખાતાઓ માટે & 31.12.2021 સુધીના સમયગાળાના નકલી / નીચી ગુણવત્તા ખાતાઓ માટે) હરાજી કરી રહ્યા છે.

ਪ਼થਮ ਫ਼ਵਾਲੀ ਗਈਮ:10.09.2022

Gandhidham: MAL-5039, MBL-4405, MDL-2659, 2861, MUL-5512, 7301, 7840, 8301, 8598, 8626, 8914, 9579, 9740, 9916, 10126, 10134, 10177, MWS-770, 1526, 1867, 1891, 2665, 5693, RGL-301 368, 913, 2550, 2749, 2780, 3123, 3541, 3590, 3707, 4074, 4190, 4290, 4311, 4666, 4676, 4682, 4684, 4688, 4705, 4743, 4751, 4810, 4834, 4840, 4843, 4860, 4872, 4939, 4959, 4960, 4967, 4987 5001, 5026, 5057, 5069, 5071, 5089, 5136, 5227, 5238, 5242, 5299, 5340, 5345, 5382, 5384, 5388, 5396, 5397, 5402, 5414, 5420, 5511, 5549, 5551, 5555, 5581, 5587, 5596, 5605, 5620, 5710, 5711 5722, 5777, 5787, 5808, 5851, 5875, 5896, 5904, 5905, 5906, 5972, 5977, 5984, 5993, Mundra-(GU): MAL-2204, 2422, 2429, MDL-1714, MUL-3580, MWS-3680, RGL-1468, 2419, 2430, 2780, 2937 2951, 3112, 3157, 3251, 3262, 3290, 3325, 3328, 3408, 3418, 3598, 3761, 3794, 3795, 3845, 3898, 3901, 3918, 3935, 3959, 3961, 3980, 3998, 4010, 4034, 4041, 4049, 4053, 4075, 4086, 4087, 4115 4123, 4124, 4126, 4139, 4169, 4180, 4187, 4192, 4199, 4221, 4255, 4286, 4334, 4360, 4390, 4398, 4418, 4483, 4491, 4498, 4515, 4517, 4527, 4548, 4559, 4564, 4568, 4570, 4572, 4580, 4606, 4630 4635, 4638, 4639, 4712, 4726, 4732, 4759, 4801, 4812, 4834, 4841, 4907, 4946, 5004, 5020, 5026, 5044, 5058, 5071, 5076, Bhuj-(GU); MDL-1076, 1574, MHP-125, MUL-5674, 6165, 6330, 6611 6807, RGL-507, 724, 980, 1124, 1201, 1592, 1715, 1872, 1908, 1944, 1978, 2034, 2078, 2079, 2082, 2095, 2120, 2128, 2129, 2133, 2136, 2144, 2151, 2152, 2179, 2192, 2220, 2255, 2272, 2284, 2306, 23070 2380, 2403, 2415, 2421, 2475, 2501, 2514, 2525, 2531, 2568, 2572, 2576, 2583, 2594, 2601, 2662, 2674, 2677, 2734, 2735, 2745, Anjar-(GU): MAL-3853, 3947, MDL-193, 2131, MUL-960, 2948, 7890 8077, 8484, 8750, 8887, 8919, 8988, 9186, 9377, 9503, 9506, 9514, MWS-1936, 2939, 3034, 3323, 3326, 4145, 4764, 4769, 4770, 4786, RGL-538, 594, 637, 796, 924, 976, 1025, 1037, 1047, 1087 1191, 1284, 1356, 1395, 1447, 1452, 1490, 1576, 1686, 1752, 1768, 1787, 1791, 2014, 2033, 2145, 2174, 2177, 2301, 2302, 2323, 2343, 2347, 2358, 2386, 2467, 2515, 2541, 2593, 2606, 2615, 2616, 2615, 2616, 2 2637, 2696, 2747, 2766, 2768, 2790, 2795, 2799, 2814, 2840, 2861, 2921, 2951, 2959, 2961, 2987, 2991, 2994, 3006, 3025, 3030, 3141, 3156, 3173, 3177, 3199, 3213, 3220, 3253, 3254, 3276, 3298 3314, 3330, 3331, 3342, 3348, 3350, 3351, 3352, 3353, 3357, 3362, 3441, 3447, 3583, 3592, 3638, 3655, 3674, 3686, 3693, 3694, 3699, 3734, 3736, 3740, Gandhidham-Tagore Road; MBL-2054 2060, MHP-130, 132, MUL-2252, 2370, 3864, 4546, 4577, 4583, 4610, 5172, 5178, 6104, 6161, 6177, 6243, MWS-958, 1889, 2396, 2914, 3084, 3919, 5249, RGL-832, 1319, 1371, 1527, 1596, 1704, 6104, 6107, 6107, 6104, 6107, 1841, 2147, 2157, 2234, 2315, 2376, 2391, 2436, 2445, 2447, 2459, 2474, 2483, 2515, 2516, 2518, 2540, 2600, 2612, 2636, 2640, 2644, 2691, 2706, 2718, 2726, 2791, 2834, 2842, 2871, 2897, 2919 2920, 2931, 2968, 2983, 2997, 3016, 3055, 3091, 3095, 3111, 3113, 3116, 3119, 3220, 3244, 3282, 3285, 3289, 3303, 3351, 3376, Mandvi-(GU): MDL-1330, MUL-2713, 2818, 2975, MWS-2103, RGL-1716, 1726, 2070, 2074, 2083, 2086, 2112, 2158, 2174, 2195, 2198, 2218, 2221, 2259, 2274, 2325, 2376, 2384, 2407, 2436, 2471, 2475, 2479, 2484, 2510, 2521, 2538, 2547, 2548, 2552, 2566 2611, 2612, 2614, 2652, 2659, 2665, 2674, 2699, 2706

이영 용민영에 리린ખ: 12.09.2022, Auction Centre: Plot No. 340, Sect 12/B, First Floor, Shop No. 4, Kailash Manas Complex, Gandhidham, Kutch-370201 પ્રથમ હરાજીની તારીખ:10.09.2022

Jam Nagar: MAL-2995, 4148, 4975, 5435, 5628, 6035, 6294, 6411, 6452, 6523, 6580, 6765, 6771, 6775, 6777, MDL-900, 2619, 2786, MUL-7454, 8722, 9562, 10601, 10920, 11341, 11348, 13342, 13365, 13691, 13953, 14275, 14915, 14921, 14958, 14972, 15038, 15115, 15176, 15218, 15236, 15237, 15253, 15268, 15269, 15274, 15323, 15325, 15358, 15360, 15361, 15416, 15549, 15550 15557, 15576, 15586, 15684, 15686, 15692, 15734, 15748, 15773, 15797, 15798, 15836, 15848, 15863, 15866, 15907, 15912, 15918, 15945, 15958, 15972, 15976, 16012, 16034, 16071, 16099 16109, 16110, 16120, Jamnacar-Khodivar Colony; MAL-3608, 3771, 3877, 4640, 4707, 4757, 4890, 4936, 5073, MBL-2962, MDL-2231, MUL-3092, 5211, 6303, 6652, 7601, 8073, 9031, 9912, 11174 11394, 11596, 11874, 12269, 12295, 12666, 12859, 13050, 13059, 13062, 13077, 13333, 13348, 13399, 13426, 13427, 13428, 13429, 13430, 13431, 13440, 13441, 13442, 13458, 13467, 13490, 13451, 13467, 134 13506, 13518, 13548, 13601, 13603, 13621, 13665, 13671, 13673, 13757, 13758, 13777, 13820, 13830, 13851, 13863, 13864, 13865, 13883, 13896, 13926, 13934, 13942, 13996, 14016, 14017 14018, 14021, Jamnagar-Khambaliya: MAL-2121, 3199, 3772, MUL-1532, 3053, 4221, 4456, 4525, 4526, 4612, 4680, 4732, RGL-1570, 1956, 2133, 2141, 2410, 2892, 2990, 3228, 3308, 3325, 3326, 3498, 3544, 3693, 4261, 4470, 4929, 4949, 5001, 5065, 5182, 5183, 5201, 5233, 5255, 5277, 5279, 5345, 5376, 5404, 5421, 5649, 5807, 5819, 5872, 5913, 6099, 6127, 6152, 6247, 6258, 6263, 6266 6273, 6311, 6320, 6338, 6364, 6433, 6478, 6483, 6487, Dhrol-(GU): MAL-1206, 1218, 1273, MUL-2305, 3478, 3948, 3999, 4048, 4065, 4301, 4307, 4323, 4330, 4371, 4383, 4404, 4409, 4413, 4424 4431, 4468, RGL-425, 519, 630, 813, 888, 914, 928, 934, 951, 981, 982, 1019, 1031, 1104, 1108, 1111, 1143, 1174, 1203, 1209, 1221, 1250, 1266, 1274, 1292, 1298, 1330, 1340, 1346, 1373, 1375, Kalavad-(GU): MAL-132, MDL-72, MUL-372, 433, 442, 443, 495, 500, 501, 502, Jamnagar-Ranjit Sagar Road: MDL-58, MUL-341, 372, 393, 397, 406, 451, 466, 468, Jam Jodhpur-Gu: MUL-68, 145 158, 160

નક્લી/નીથી ગુણવત્તા: Jam Jodhpur: MUL-108

에앬 용민영에 디린ખ: 13.09.2022, Auction Centre: First Floor, Shivam Complex, Near Anupam Cinema, Teenbatti, Jamnagar, Gujarat-361008

ਪ੍ਰથਮ ਫ਼ਵਾਲਾਂਗੀ ਗਦੀਯ:10.09.2022

Rajkot-Gujarat: PPL-3678, Rajkot-Sorathiyawadi: MAL-2284, MUL-5308

ଦାଖି ବ୍ୟେଖିକା ପାର୍ଯ୍ୟ : 14.09.2022, Auction Centre: Sugar House, First Floor, Dheber Road, Near Trikonbaug, Rajkot-360 001

પ્રથમ હરાજાની તારીખ:10.09.2022

Morbi -Gujarat: MAL-2321, 2361, MDL-1513, MUL-4008, 4190, 4674, 4762, 5137, MWS-1792, 3882, 3947, 4456, 5140, RGL-518, 1767, 1776, 2008, 2050, 2167, 2251, 2310, 2344, 2394, 2461, 2481 2889, 2890, 3067, 3175, 3215, 3275, 3332, 3417, 3466, 3549, 3550, 3569, 3594, 3650, 3660, 3714, 3744, 3764, 3773, 3799, 3801, 3851, 3863, 3880, 3893, 3936, 3942, 3973, 3977, 3987, 4032, 4034 4066, 4073, 4085, 4134, 4165, 4174, 4183, 4195, 4220, 4263, 4294, 4296, 4320, 4326, 4355, 4364, 4371, 4380, 4389, 4395, 4418, 4423, 4426, 4429, 4459, 4477, 4536, 4570, 4584, 4585, 4638 4647, 4653, 4670, 4693, 4760, 4800, WBS-2, Wankaner-(GU): MUL-1769, 1788, 2597, 2639, 2973, RGL-1688, 2161, 2196, 2256, 2330, 2466, 2549, 2686, 2731, 2756, 2770, 2848, 2862, 2887, 2888 2924, 2993, 3006, 3041, 3070, 3073, 3087, 3105, 3109, 3114, 3118, 3120, 3121, 3145, 3173, 3191, 3208, 3235, 3256, 3278, 3282, 3325, 3350, 3375, 3376, 3396, 3422, 3431, 3449, 3455, 3457, 3479 3480, 3522, 3523, 3525, Halvad (GU): MAL-20, 32, MDL-56, MUL-246, 271

ଦାଖି ଛେଥାଡ଼ୀ ପାର୍ଯ୍ୟା: 15.09.2022, Auction Centre: First Floor, Shop No. 1 Bhavani Trade Centre, Sardar Road, Morbi, Gujarat. શાખાના મથાળા હેઠળ દેખાડવામાં આવેલા લોન ખાતાઓ સંબંધી હરાજી જે તે શાખામાં સંચાલિત કરવામાં આવશે.

તેમ છતાં કૃપા કરી એ વાતની નોંધ લો કે જો હરાજી આપવામાં આવેલી તિથિ (ઓ) પર પૂરી ન થાય, તો તેવી સ્થિતિમાં તે સંબંધી હરાજી **બીજી હરાજીની તારીખ** ચથાક્રમ **આચેલ હરાજી** ફેન્દ્ર ખાતે સંચાલિત કરવામાં/ચાલુ રાખવામાં આવશે અને આગળ તેમ છતાં જો ઉપરોક્ત ઘરેણાઓની આ તિથિઓ પર સફળતાથી હરાજી ન થઈ શકે, તો આવી હરાજીને તે પછી આવતા દિવસોમાં, તે જ સ્થળે, ચાલુ રાખવામાં આવશે. તે સંબંધમાં આગળ કોઈ પણ સૂચનાઓ આપવામાં નર્હિ આવે.

કોહલી એંડ સોબતી, એડવોકેટ્સ, એ 59એ, પહેલો માળ, લાજપત નગર-11, નવી દિલ્હી - 110024

नोंद्यः ગ્રાહકો અમારા અસીલની લેણી નીકળતી રકમની ચૂકવણી કરી હરાજીની સૂચિત તિથિ પહેલાં તેમના ગીરો મૂકેલા ઘરેણા છોડાવી શકે છે. ગ્રાહક પણ સંપર્ક કરી શકે છે auctiondelhi@muthootgroup.com મોબાઇલ નંબ૨ 7834886464, 7994452461.

HindPrakash

CIN: L24100GJ2008PLC055401 २िष्टर्ड ओक्सि: ३०१, ढिव्हप्रकाश ढाઉस, प्लोट नं.१०/५, જીઆઈડીસી, વટવા, અમદાવાદ.૩૮૨૪૪૫, ગુજરાત, ઇન્ડિયા. ટેલિફોન.: ૬૮૧૨७૦૦૦/૧૦; ઇમેલઆઇડીઃ info@hindprakash.com; વેબસાઇટઃ www.hindprakash.in

१४मी पार्षिङ सामान्य सलानी सूयना

આથી નોટિસ આપવામાં આવે છે કે હિન્દપ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ૧૪મી વાર્ષિક સામાન્ય સભા ("એજીએમ") મંગળવાર, સપ્ટેમ્બર ૨૭, ૨૦૨૨ના રોજ બપોરે ૧૨:૧૫ વાગ્યે, વિડિઓ ક્ષેન્ફરન્સ (વીસી)/અન્ય ઓડિઓ વિઝ્યુઅલ માધ્યમ (ઓએવીએમ) દ્વારા યોજવામાં આવશે, જે કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્ર નંબર ૧૪/૨૦૨૦ તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦, સામાન્ય પરિપત્ર નં. ૧૭/૨૦૨૦ તારીખ ૧૩ એપ્રિલ, ૨૦૨૦, સામાન્ય પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તારીખ ૦૫ મે, ૨૦૨૦, સામાન્ય પરિપત્ર નં. ૨૨/૨૦૨૦ તારીખ ૧૫ જૂન, સામાન્ય પરિપત્ર નં. ૨૦૨૦ નં 33/૨૦૨૦ તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૦, સામાન્ય પરિપત્ર નં. ૩૯/૨૦૨૦ તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦, સામાન્ય પરિપત્ર નં. ૧૦/૨૦૨૧ તારીખ ૨૩ જૂન, ૨૦૨૧, સામાન્ય પરિપત્ર નં. ૧૯/૨૦૨૧, સામાન્ય પરિપત્ર નં. ૦૨ /૨૦૨૧ તારીખ ૦૮ ડિસેમ્બર, ૨૦૨૧ અને સામાન્ય પરિપત્ર નં. ૨૧/૨૦૨૧ તારીખ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧ અને સામાન્ય પરિપત્ર નં. ૦૩/૨૦૨૨ તારીખ ૦૫ મે, ૨૦૨૨ અને સેબીના તારીખ ૧૨મી મે, ૨૦૨૦ અને ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૧ ના પરિપત્રો (સામુહિક રીતે પરિપત્રો તરીકે ઓળખાતા) ના પાલન અનુસાર, શેર ધારકોની પ્રત્યક્ષ હાજરી વિના, એજીએમની નોટિસમાં દર્શાવ્યા મુજબનું કામકાજ કરવામા માટે યોજાશે.

ઉપરોક્ત પરિપત્રોનું પાલન કરીને, એજીએમની સૂચનાની ઇલેક્ટ્રોનિક નક્લો જેમના ઇમેઇલઆઈડી કંપની/ ડિપોઝિટરી સહભાગી (ઓ) સાથે નોંધાયેલા છે, તે બધા શેરધારકોને મોક્લવામાં આવેલ છે. એજીએમની નોટિસ કંપનીની વેબસાઇટ www.hindprakash.in પર અને નેશનલ સ્ટોક એક્સચેંજ ઓફ ઇન્ડિયા લિમિટેડની વેબસાઇટ www.nseindia.com પર પણ ઉપલબ્ધ છે.

ઈ-વોટિંગ માટે ની સૂચના :-

કંપની તેના શેરધારકોને કંપની ધારા, ૨૦૧૩ની ક્લમ ૧૦૮ ની જોગવાઈઓ અને અંતર્ગત બનાવેલા સંબધિત નિયમો અને સેબી (એલઓડીઆર) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના રેગ્યુલેશન ૪૪ ની જોગવાઈઓ અનુસાર રિમોટ ઈવોટિંગ સુવિધા પૂરી પાડેલ છે. કેંપની તેના શેરધારકોને ઈવોટિંગ સુવિધા પૂરી પાડવા માટે અધિકૃત એજન્સી તરીકે સીડીએસએલ (CDSL) ની નિમણંક કરેલ છે.

ઇલેટ્રોનિક વોટિંગ હ્રારા વોટ આપવાની પાત્રતા નક્કી કરવા માટેની કટ-ઑફ તારીખ સપ્ટેમ્બર ૨૦, ૨૦૨૨ છે. રિમોટ ઈવોટિંગની સુવિધા ૩(ત્રણ) દિવસ માટે સપ્ટેમમ્બર ૨૪, ૨૦૨૨ ના રોજ સવારે ૦૯:૦૦ ક્લાકે શરૂ થતા, સપ્ટેમ્બર ૨૬, ૨૦૨૨ના રોજ સાંજના ૫:૦૦ ક્લાક સુધી બધા શેરધારકો માટે ખુલ્લી રહશે.

રિમોટ ઈવોટિંગની સુવિધાને ઉપરોક્ત તારીખ અને સમયની આગળ મંજૂરી આપવામાં આવશે નહિ. જે શેરધારકો વીસી, ઓએવીએમ સુવિધા હારા એજીએમમાં હાજર થયા હશે અને રિમોટ ઈવોટિંગ હારા ઠરાવ પર પોતાનો વોટ આપ્યો નહિ હોય તેવા શેરધારકોને એજીએમ દરમ્યાન ઈવોટિંગ સુવિધા દ્વારા વોટ આપવાનો અધિકાર રહશે.

રિમોટ ઈવોટિંગ દ્વારા પોતાના વોટના અધિકારનો ઉપયોગ કર્યા પછી પણ શેરધારકો બેઠકમાં ભાગ લઈ શકે છે. પરંત્ મિટિંગ દરમિયાન ફરીથી વોટ આપવાનો અધિકાર નહિ રહે. રિમોટ ઈવોટિંગ સુવિધા અને એજીએમ દરમ્યાન ઈવોટિંગ માટેની વિગતવાર સૂચના એજીએમની નોટિસમાં જ્ણાવેલ છે. કંપની/ ડિપોઝિટરી સહભાગી/ રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ પાસે જે શેરધારકોની ઇમેઇલઆઈડી નોંધાયેલ નથી

અને ઈવોટિંગ/ રિમોટ ઈવોટિંગ દ્વારા વોટ આપવા ઇચ્છુંક છે તેવા શેરધારકોને માટે રિમોટ ઈવોટિંગ સુવિધા અને એજીએમ દરમ્યાન ઈવોટિંગ માટેની વિગતવાર સૂચના એજીએમની નોટિસમાં જ્યાવેલ છે. કોઈપણ વ્યક્તિ જે નોટિસ મોક્લ્યા પછી શેર ખરીદશે અને કંપનીના શેરધારક બનશે અને ક્ટ-ઑફ તારીખ પ્રમાણે જો શેર ધરાવતા હશે, તો તેઓ એજીએમની નોટિસમાં આપેલી ઈવોટિંગેની સૂચનાઓ અને પ્રક્રિયાને અનુસરીને વોટ આપી

શેરધારક કે જેમને પોતાનું ઇમેઇલઆઈડી નોંધાવ્યું નથી, તેઓ ઈમેલઆઈડીની નોંધણી માટે તેમના સંભંધિત ડિપોઝિટરી સહભાગીનો સંપર્ક કરવા વિનંતી છે.

ઈવોટિંગ/ રિમોટ ઈવોટિંગ લગતા તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ હોય તો, તમે CDSL ની વેબસાઈટ www.evotingindia.com ઉપર હેલ્પ સેક્શનમાં "FAQs" અથવા ઈવોટિંગ મેન્યુઅલ રિફર કરી શકો છો, અથવા તમે શ્રી રાકેશ દલ્વી, મેનેજર ઈવોટિંગ, CDSL25 મો માળ, એવિંગ, ૨૫મો માળ, એ-પાંખ, મેરેથોન ક્યુચર એક્સ મફતલાલ મિલ્સ કમ્પાઉન્ડ, એન.એમ. જોશી માર્ગ, લોઅરપરેલ (ઈ), મુંબઇ-૪૦૦૦૧૩ ને સંપર્ક કરી શકો છો અથવા helpdesk.evoting@cdslindia.com પર ઇમેઇલ કરી શકો છો અથવા તો ફોન.ન. ૦૨૨-૨૩૦૫૮૭૩૮ અથવા ૦૨૨- ૨૩૦૫૮૫૪૩ અથવા ૦૨૨-૨૩૦૫૮૫૪૩૨ ૫૨ બધા કાર્યકારી દિવસો ૫૨ સંપર્ક કરી શકો છો.

તારીખઃ ઓગષ્ટ ૩૧, ૨૦૨૨

સ્થળ : અમદાવાદ

શકશે.

હિન્દપ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વતી, સહી/- ઉત્સવ ત્રિવેદી કપંની સેક્રેટરી એન્ડ કમ્પ્લાયન્સ ઓફિસર

🗕 એક્સિસ બેંક

એક્સિસ બેન્ક લિમીટેડ (CIN: L65110GJ1993PLC020769) રજિસ્ટર્ડ ઓફિસઃ "ત્રિશુલ", ૩જો માળ, સમર્થેશ્વર મંદિરની સામે, લો ગાર્ડન, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ <mark>ઝમદાવાદ ખાતેની કોર્પોરેટ બેન્કિંગ ભાંચ ખાતે સ્ટ્રક્ચર્ડ એસેટ્સ ગ્રુપ</mark>ઃ કોર્પોરેટ બેન્કિંગ બ્રાંચ ખાતે સ્ટ્રક્ચરર્ડ એસેટ્સ ગ્રુપ ૩ આઇ બિલ્ડીંગ, રજો માળ, પંચવટી સર્કલ, સી.જી. રોડ, અમદાવાદ -૩૮૦૦૦૮. ઇમેઇલ ઑઇડી : jitendra.popat@axisbank.com; nilay.sharan@axisbank. સિલ્લોદઃએક્સિસ બેન્ક લિમીટેડ, ગ્રાઉન્ડ ફ્લોર, બાયપાસ રોડ, સુર્યકિરણ, સિલ્લોદ, શિવાજીનગર, ઔરંગાબાદ, મહારાષ્ટ્ર, ૪૩૧૧૨.

સ્થાવર મિલ્કતના વેચાણ માટેની વેચાણ નોટીસ પુરવર્શી-૪-એ [સિક્ચુરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રુલ્સ, ૨૦૦૨, ૨૦૦૨ના નિયમ ૮(૬)} સાથે વાંચતા

સિક્ચોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (સરફેસી એક્ટ ૨૦૦૨) હેઠળ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮ (૬) અને નિયમ ૯ ની જોગવાઈ સાથે વંચાતી સ્થાવર મિલ્કતોના વેચાણ માટેની ઇ-હરાજી વેચાણ નોટિસ.

આથી જાહેર જનતાને સામાન્ય રીતે અને ખાસ કરીને કરજ લેનારને એટલે કે ૧) મેસર્સ પરવિન કોટગીન પ્રાઈવેટ લિમિટેડ બી-૨૦૨, સફલ સોલિટેર કોર્પોરેટ પાર્ક, દિવ્યભાસ્કરની નજીક, એસ.જી. હાઈવે, મકરબા, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૫૧ અને ગટ નંબર ૪૨૯, ૪૩૦ પર, ગામ-ડોંગરગાંવ, તાલુકો સિલ્લોડ, ઔરંગાબાદ, મહારાષ્ટ્ર-૪૩૧૧૧૨ ખાતે પણ અને ગીરવેદાર/જામીનદારો એટલે કે.૨) શ્રી તૌસીક એ વ્હોરા, ૩) શ્રી તનવીર એ. વ્હોરા, ૪) શ્ર્ નસીરુદ્દીન એ. વ્હોરા પ) શ્રી અકબરભાઈ એન વ્હોરા, પ, નૂર મોહમ્મદ સોસાયટી, પાસે. અમૃતબાગ, બાવળા ખાતે, અમદાવાદ — ૩૮૨૨૨૦ ખાતે અન્ ૬) પરવીન એગ્રો પ્રા. લિમિટેડ. એ-પ૦૭, સફલ સોલિટેર કોર્પોરેટ પાર્ક, દિવ્યભાસ્કર પાસે, એસ.જી. હાઇવે, મકરબા, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૫ ગ ફ) પરવીન એગ્રા પ્રા. લિમિટેડ. એ-પ૦૭, સકલ સાલિટેર કોપારેટ પાક, દિવ્યભાસ્કર પાસ, એસ.જી. હાઇવે, મકરળા, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૫૧ ખાતે તેમજ રૂપલ રોડ, બાવળા, અમદાવાદ -૩૮૨૨૨૦ને, નીચે વર્ણવેલ સ્થાવર મિલકત એક્સિસ બેંક લિમિટેડ પાસે ગીરો/ચાર્જ કરવામાં આવી છે એટલે કે સિક્યોર્ડ કેડિટર, જેનો ભૌતિક કબજો એક્સિસ બેંક લિમિટેડના અધિકૃત અધિકૃત અધિકૃત લિમોટા લેવામાં આવ્યો છે, એટલે કે, ૧) મેસર્સ પરિવિન કોટગીન પ્રાઈવેટ લિમિટેડ અને ગીરવેદાર/જામીનદારો એટલે કે ૨) શ્રી તૌસીફ એ લ્હોરા, ૩) શ્રી તત્નીર એ. લ્હોરા, ૪) શ્રી નસીરુદ્દીન એ. લ્હોરા, પ) શ્રી અકબરભાઈ એન. લ્હોરા અને ૬) પરવીન એશ્રો પ્રા. લિથો એક્સ્સ બેંક લિમેટેડ એટલે કે સિક્યોર્ડ કેડિટરને સિક્યોર્ડ કેડિટરનું વેચાણ "જેમ છે તેમ", "જેમ છે તેમ", અને 'લેજે છે તે જે અને "કોર્સ નહીના ધોરણે રગ્ની સાર્ટમ્બર, ૨૦૨૨ના રોજ, રૂ. ૧૫,૫૪,૩૧,૩૪૯/- (રૂપીય પંદર કરોડ એકાવન લાખ એકનીસ હજાર ત્રણસો ઓગણચાલીસ પૂરા)ની વસૂલાત માટે, જેમ ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૦ની માગણા નોટિસમાં દર્શાવેલ છે તે અનુસાર સરકે સી એક્ટની કલમ ૧૩ (૨) હેઠળ, ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૭ની સાથે ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૭ થી કરારના દરે વધુ વ્યાજ સાથે ચૂક્વણીની તારીખ સુધીના દંડના વ્યાજ સાથે અને એક્સિસ બેંકના આકર્સિમક ખર્ચ, ચાર્જીસ, ખર્ચ વગેરે સાથે એક્સિસ બેન્ક લિમીટેડ એટલે કે સિક્યોર્ડ કેડિટરને ચૂકવણી કરવાની નિટિસ આપવામાં આવે છે. કરવાની નોટિસ આપવામાં આવે છે. વેચાશ માટે ગીરો મૂકેલી મિલકતોનું વર્શન અનામત કિંમત અને બાનાની ડિપોઝિટ સાથે નીચે મુજબ છેઃ

ક્રમ નં.	મિલ્કતનું વર્શન	અનામત કિંમત	અનસ્ટ મના ડીપોઝીટ (ઇએમડી)
٩.	જમીન ક્ષેત્રફળ ૪૦આર અને ૧ હેક્ટર પર આર અને ૧ હેક્ટર પર આર ખાતે આવેલી જે ૧૯૨૦૦ ચો.મીટરની સમકક્ષ થાય છે, જે ગટ નં. ૪૨૯ અને ગટ નં. ૪૨૯ અને ૪૩૦ હેઠળ છે, જેનો આરએસડી નં. ૪૪૧૩, ૪૧૮૪, ૧૯૬૬ અને ૩૨૮૭ છે જે ગામ ડોંગરગાંવ, તાલુકા, સિલ્લીદ, જિલ્લો: ઓરંગાબાદ ખાતે આવેલી છે તેની સાથે તેની પરના બિલ્હીંગ અને સ્ટ્રક્ચર્સ અને અથવા પૃથ્વી સાથે જોડાયેલ કાયમી ધોરણનું કંઈ પણ, જે પવિન કોટગીન મા. ફ્લિમીટેડના નામે (જંગમ મિલ્કતો/મિલ્કતો/મશીનરી કે જે આ મિલ્કતમાં પડેલી હોય જે બેન્કમાં હાયપોથીકેટ કરેલી હોય તે સિવાય).	(રૂપિયા પાંચ કરોડ પૂરા)	રૂ. ૫૦,૦૦,૦૦૦.૦૦ (રૂપિયા પચાસ લાખ પૂરા)
માર્ગાણક કરેના મુખ્ય કે જે ત્રિક ૧૮ ડે.લા એટલે કે મિલ્ફાઉટાઇન્ડેશન એપ્લીકેશન નં ૨૦૧૭ની ૮૯ જિલ્લા મેજિસ્ટેટ ઔરંગાણાક			

કેબ્રુઆરી ૨૦૧૮ના રોજ પસાર કરાયેલા આદેશ અનુસાર ૦૮મી કેબ્રુઆરી ૨૦૨૨ના રોજ મામલતદાર, સિલ્લોદ હોરો ઔરંગાબાદ – સિલોડની મિલકતનો ભૌતિક કબજો લેવામાં આવ્યો હતો અને ભૌતિક કબજો એક્સિસ બેંક લિમિટેડના અધિકૃત અધિકારીને સોંપ્યો હતો. ઝોનલાઈન **બિડ નીચે આપેલ સમ**ચપત્રક મુજબ સુપરત કરવામાં આવશે

ઉંઃક અને ઇએમડી સિલ્લોદ ખાતે ચૂકવવાપાત્ર 'એક્સિસ બેન્ક લિમિટેડ'ની તરફેણમાં ડિમાન્ડ ડ્રાફ્ટ/પે ઓર્ડર, **૨૧મી સપ્ટેમ્બર ૨૦૨૨**ના રોજ અથવા તે પહેલાં સાંજે પ:00 વાગ્યા સુધીમાં નીચેના સરનામે સુપરત કરવાનો રહેશે :- **સિલ્લોદ**- એક્સિસ બેંક લિ. ગ્રાઉન્ડ ફ્લોર, બાયપાસ રોડ, સુર્યકિરણ, સિલ્લોદ, શિવાજી નગર, ઔરંગાબાદ, મહારાષ્ટ્ર, ૪૩૧૧૧૨. કે/એઃ શ્રી રાહુલભાટ અથવા <mark>કોર્પોરેટ બેલ્કિંગ શાળામાં સ્ટ્રક્ચર્ડ એસેટ્સ ગૂપ</mark> ઉજી આઇ બિલ્ડીંગ, રેજા માળે, પેચવટી સર્કલ પાસે, સીજી રોડ અમદાવાદ-૩૮૦૦૦૯.કે/એઃ શ્રી જીતેન્દ્ર પોપટ નારીખ भिस्डतनं निरीक्षण ૨૦, સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી પૂર્વ એપોઇન્ટમેન્ટ સાથે. નિરીક્ષણ માટે કૃપા કરીને શ્રી મનીષ જુઝારે (એલિક્સિર સ્ટ્રેટેજિક નાગપુર) (એજન્સી કો-ઓર્ડિનેટર ફોર્ને: ૭૦૨૦૦૩૮૦૯૫નો સંપર્ક કરો. <mark>૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ બપોરે ૨.૦૦થી ૩.૦૦ વાગ્યાની વચ્ચે.</mark> છેલ્લી પાંચ મિનિટમાં બિડ મુકવામાં આવે તો દરેક પાંચ મિનિટના દ-હરાજીની વારીખ પ્રત્યેકમાં આપોઆપ વિસ્તરણ સાથે. અને સમય • મિલકત (સિલ્લોદ-ઔરંગાબાદ) - રૂ. ૨,૦૦,૦૦૦/ - (રૂપિયા બે લાખ પૂરા) બીડ વધારા રકમ સિલ્લોદ-ઔરંગાબાદ મિલકત

કરજદારો/માલિકો/ગીરવેદારો ૨૦૧૮માં સ્પેશિયલ લિવ એપ્લીકેશન નંબર ૧૧૩૧૨ ("SCA") નામની ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સરફેસી એક્ટ હેઠળ અમારી બેંક દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીને પડકારતી અરજી કરી હતી. ૨૪મી જુલાઈ ૨૦૧૮ ના રોજ માનનીય ગુજરાત હાઈકોર્ટના આદેશ દ્વારા આ એસસીએને બરતરફ કરવામાં આવે છે.

જામીનદારો સામે ૨૦૧૭ની મૂળ અરજી નંબર ૨૫૫ ("OA") ફાઇલ કરી હતી. ઉક્ત OA નિર્ણય માટે બાકી છે.

એક્સિસ બેંક લિ.એ માનનીય દેવા વસૂલાત ટ્રિબ્યુનલ-l અમદાવાદમાં બાકી લેશાંની વસૂલાત માટે કરજદારો, ગીરવેદારો અને

એસસીએમાં માનનીય ગુજરાત હાઈકોર્ટ દ્વારા ૨૪મી જુલાઈ ૨૦૧૮ના રોજ પસાર કરાયેલા આદેશથી નારાજ થઈને કરજદારો/માલિકો/ગીરવેદારોએ માનનીય ગુજરાત હાઈકોર્ટ સમક્ષ લેટર પેટન્ટ અપીલ નંબર ૧૦૨૫ ઓફ ૨૦૧૮ ("LPA") દાખલ કરી હતી. ૧૭મી ઓગસ્ટ ૨૦૨૦ના રોજ માનનીય ગુજરાત હાઈકોર્ટના આદેશ દ્વારા ઉક્ત એલપીએને બરતરફ કરવામાં આવે છે. . બિડ સુપરત કરતા પહેલા બિડર્સ દ્વારા ખાતરી કરવા અને ચકાસવા માટે વૈધાનિક સત્તાના ''ઋણ લેનાર કંપની (પર્વિન કોટગીન પ્રાઇવેટ લિમિટેડ) એકાઉન્ટ્સ પર વિવિધ જોડાણો છે"

વેચાણની વિગતવાર નિયમો અને શરતો માટે, કૂપા કરીને https://www.axisbank.com/auction-notices અને / અથવા https://axisbank.auctiontiger.netમાં આપેલી લિંકનો સંદર્ભલો. **સહી/**-

અધિકૃત અધિકારી એક્સિસ બેન્ક લિમીટેડ

ક્ષળઃ અમદાવાદ મોબાઇલ નં.: ૯૨૨૮૮૯૮७૮૨